

ત્વરિત જાહેરાત માટે

સ્થાનિક ઉદ્યોગો, ઉદ્યમીઓ અને વિદેશી રોકાણકારો માટે નવી વેબસાઇટ InvestBrampton.ca ટૂલ્સ અને સંસાધનો પૂરા પાડે છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (03 જૂન 2020) – આજે, સિટીએ વધી વેબસાઇટ InvestBrampton.ca શરૂ કરી, જે સ્થાનિક વ્યવસાયો, સાહસિકો અને સંભવિત વિદેશી રોકાણકારો માટે કેન્દ્રીય ઓનલાઇન સ્ત્રોત પૂરો પાડે છે જેથી બ્રમ્પટનમાં સ્થળ શોધવા કે તેમના વ્યવસાયનો વિકાસ કરવા તેમને આવશ્યક એવી માહિતી અને સંસાધનો મેળવી શકાય. નવી વેબસાઇટ InvestBrampton.ca [સિટીના અર્થતંત્રને ફરી બેઠું કરવાના વ્યુહ](#) માટે ભરાયેલ તાકીદના પગલાં તરીકે ગણવામાં આવે છે.

વ્યહવારની આપલે કરવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીને, વેબસાઇટ સ્થળ પસંદગીકર્તાઓ, સંભવિત રોકાણકારો અને સ્થાનિક ઉદ્યોગોને ઝડપથી અને સરળતાથી માહિતી શોધવા અને નિષ્ણાત સલાહકારો સાથે જોડાઈ શકાશે. નવી સુવિધાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: એક કેન્દ્રીય સંસાધનોનું પૃષ્ઠ, એક સાઇટ પસંદગીનું સાધન અને નવી રોકાણ સેવાઓની ટીમ સુધી સીધી પહોંચ જે સંભવિત રોકાણકારો માટે વ્યક્તિગત, જરૂરિયાત મુજબની સેવા પ્રદાન કરે છે. સાઇટમાં ચેટ ક્ષમતા પણ છે.

મે 13ના રોજ બ્રમ્પટન કાઉન્સિલે અર્થતંત્રને પુનર્જીવન આપવા માટેના વ્યુહને સિટી માટેના માળખા તરીકે મંજૂરી આપી જેથી સ્થાનિક અર્થતંત્રને પુન: શરૂ કરીને આગળ વધી શકાય. મેયરના COVID-19 ઈકોનોમી સપોર્ટ ટાસ્ક ફોર્સ દ્વારા સિટીના સિટીના અર્થતંત્રને ફરી બેઠું કરવાના વ્યુહના વિકાસમાં માર્ગદર્શન પૂરું પડાયું હતું જે ચાર સ્તંભોમાંથી એક એક હેઠળ કાર્ય હાથ ધરીને હાંસલ કરાશે: ઈનોવેશન, ટેકનોલોજી અને સાહસિકતા, નિવેશ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને કલા, સંસ્કૃતિ અને પ્રવાસન.

બ્રમ્પટનનાં આર્થિક પુન:ઉત્થાનને ટેકો આપવા માટે તાજેતરમાં શરૂ કરાયેલ અન્ય પહેલ સામેલ છે સિટીનું [સપોર્ટ લોકલ અભિયાન](#) અને [ડિજિટલ શોપહિઅર \(ShopHERE\) પ્રોગ્રામ](#).

બ્રમ્પટનમાં લગભગ 74,000 વ્યવસાયો ધમધમે છે. 2019 માં બ્રમ્પટન આંત્રપ્રુન્યોર સેંટરે લગભગ 1,000 લઘુ ઉદ્યોગો સાથે પરામર્શ કર્યો અને 10,000 કરતા વધુ લઘુ ઉદ્યોગ પૂછપરછોને જવાબ આપ્યા હતાં.

અવતરણો

"બ્રમ્પટનનાં આર્થિક પુન:ઉત્થાન, પર અમે કાર્ય ચાલુ રાખી રહ્યા છે, જ્યારે આપણા હાલના વ્યવસાયોને જાળવી રાખવા અને વિસ્તારવાનું કામ કરીએ છીએ તેમજ આપણા સિટીમાં નવા નિવેશો લાવીએ છીએ ત્યારે તે અમારે માટે અગત્યના ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતો છે. આ

નવી વેબસાઈટ એવી રીતો પૈકી એક છે જેના થકી અમે આપણા પ્રસ્થાપિત વ્યવસાયોને મદદરૂપ થઈશું અને બ્રેમ્પટન એક આદર્શ રોકાણ કરવાના સ્થળ તરીકે ક્યા લાભ આપી શકે છે તેને દર્શાવશે!"

– પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"આપણે સંભવિત નવા નિવેશકારો સાથે જોડાવાના નવા માર્ગો શોધવાના છે ખાસ કરીને વિદેશી નિવેશકારો જેથી આપણે COVID-19 માંથી આર્થિક પુનઃઉત્થાન તરફ આગળ વધી શકીએ. નોંધપાત્ર રીતે આપણે આપણો અભિગમ ફોરિન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ તરફ આપણે જે રીતે વેપાર કરીએ છીએ તેની નવતર રીતે તરીકે અને તેના ભાગ તરીકે ખસેડવો પડશે. આપણા રૂબરૂ વાર્તાલાપો અને સંબંધો સ્થાપવાના પ્રયાસો ઉપરાંત investbrampton.ca આપણા સંભવિત નવા નિવેશકારોને ઘણી બધી પ્રારંભિક માહિતી સરળતાથી પહોંચાડશે અને તે પણ એક જ જગ્યા પરથી."

– પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર વોર્ડ 1 અને 5, સહ-પ્રમુખ, મેયરનો COVID-19 ઇકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ

"COVID-19 દરમિયાન ઇકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ સ્થાનિક વ્યવસાયો સાથે ખંતપૂર્વક કાર્ય કરી રહ્યું છે અને તે આ ટેકો જાળવી રાકવા પ્રતિબદ્ધ છે જેથી આપણું સ્થાનિક અર્થતંત્ર ફરી ઊભું થાય અને વધુ મજબૂતીથી બહાર આવે. આપણો અર્થતંત્રને ફરી બેઠું કરવાનો વ્યુહ સિટીની સ્થિતિસ્થાપકતા જાળવવામાં મદદ કરશે અને આપણે આગળ વધીશું ત્યારે સ્પર્ધાત્મક લાભ પૂરો પાડશે."

– માર્કવ પેલેશી, રીજનલ કાઉન્સિલર વોર્ડ 2 અને 6, સહ-પ્રમુખ, મેયરનો COVID-19 ઇકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ

"આખા શહેર ફરતેના વ્યવસાયો અને સંસ્થાઓની જેમ જ આપના શહેરને પન COVID-19 નાં નકારાત્મક પ્રભાવનો સામનો કરવો પડ્યો છે. વિકાસ સાધવા માટે આપણે માટે આર્થિક પુનઃઉત્થાન ધ્યાન કેન્દ્રિત કરવાનો મુદ્દો છે અને અમે અનેક પહેલો પર નજર નાંખીશું જેનું સંયોજન આપણો વિકાસ સાધશે."

– ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया ओन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूहात्मक संवाद

सीटी ओफ़ ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca